युको बैंक

UCO BANK

PREMISES REQUIRED

Zonal Office: UCO Bhawan, Nr. Sanyas Ashram, Ashram Re Ahmedabad - 380009. Ph: 079 - 40176927, (M): 9680165550

Bank desires to take premises on rent having 1000 - 1200 sq. ft. of carpet area preferably or Ground Floor or Premises on first floor if the same is in Malls, Shopping Centers when infrastructure facilities like lifts, escalators are available. The premises are required in the following localities for Shifting of its Branch/Office: Bhavnagar Under Ahmedabad Zone

The details may be collected from Bank's Bhaynagar Main branch (Mobile No. 9583717392) /Zonal Office, Nr. Sanyas Ashram, Ashram Road, Ahmedabad (Contact No. 079-40176927) or can be downloaded from our Bank's website at www.ucobank.co The last date of application in sealed cover on prescribed format is 07.02.2023 upto 05:00

Deputy General Manager

Indiabulls

Indiabulls Asset Reconstruction Company Limited

One International Center, 4th Floor, Tower 1, Elphir Road, Mumbai 400013

Appendix - IV Possession Notice (see rule 8 (1) (for Immovable/movable property)

Whereas, the authorized officer of Indiabulls Asset Reconstruction Compan **_imited** (Acting in its Capacity as Trustee of Indiabulls ARC -XIV Trust) under th Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13 (12), 13(2) read with rule 3 of the security Interest (Enforcement) Rules 2002 issued **Demand Notice** dated 31.07.2020 calling upon the borrower/co-borrower & proprietor / mortgagor · Welspun Enterprises (Borrower), Lalitgiri D Goswami (Co-Borrower and Proprietor), Dhaneshvargiri B Gosai (Co-Borrower and Mortgagor), Meetalben L Goswami (Co-Borrower and Mortgagor), Labhuben D Goswami (Co-Borrower) Kamleshgiri D Goswami (Co-Borrower), Dilip Moliya (Co-Borrower) to repay the amount mentioned in the said notice being Rs.45,44,495.82 (Rupees Forty Five akhs Forty Four Thousand Four Hundred Ninety Five and Paise Eighty Two only) as on 31.07.2020 together with further interest plus costs, charges and expenses etc within 60 days from the date of receipt of the said notice.

Further the IndusInd Bank Limited has assigned all its rights, title and nterest of the entire outstanding debt of above loan account along with underlying securities in favour of **Indiabulis Assets Reconstruction Company Ltd.** vide an Assignment Agreement dated 30.03.2020 entered between IndusInd Bank Ltd and ndiabulls Assets Reconstruction Company Ltd. under the provisions of Section 5 of SARFAESI Act 2002.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrowe and the public in general that the undersigned has taken possession of the properties described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this the 29th Day of January of the year 2023.

The borrower in particular and the public in general is hereby cautioned not to dea with the properties and any dealings with the properties will be subject to the charge of Indiabulls ARC for an amount of Rs.45,44,495.82 (Rupees Forty Five Lakhs Forty Four Thousand Four Hundred Ninety Five and Paise Eighty Two only) as on 31.07.2020 together with further interest plus costs, charges and expenses etc. incurred thereon. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect).

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Description of Immovable/movable Property.

All that piece and parcel of immovable residential property of Revenue Survey No.16 &17, Sub-Plot No 16/C, "Matru Chhaya", 5, Vivekanand Nagar, Street No. 14, Kothariya Main Road, admeasuring 90-7-72 Sq. Yards including Private Path with building there on of Survey No 259 Paiki of Raikot and bounded as under: North: Land of Private Patr East: Others Property South: Others Property West: Others Property.

Sd/- Authorised Office Dated: 29th January, 2023 Indiabulls Asset Reconstruction Company Limi Place: Rajkot (Acting in its Capacity as Trustee of Indiabulls ARC -XIV Trust

Tamilnad Mercantile Bank Limited

Ringroad Branch:

Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh House, Kinnary Cinemas Ringroad Branch, Surat - 395002, Gujarat Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

Auction Notice for Sale of Immovable Properties

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provison to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) M/s. Bhavna Textile, Proprietrix: Mrs. Vaghasiya Bhavnaben Harsukhbhai, W/o. Vaghasiya Harsukhbhai Laljibhai and the Guarantor Mr. Vaghasiya Harsukhbhai Laljibhai, S/o.Vaghasiya Laljibhai Guarantor Mr.Thummar Nareshbhai Dhirubhai, S/o. Dhirubhai Lakhamanbhai Thummar. that the below described immovable properties mortgaged / charged to the Secured Creditor and the constructive possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch, (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 20.02.2023, for recovery of Rs.1,00,71,458.42 (Rupees One Crore Seventy One Thousand Four Hundred Fifty Eight and Paise Forty Two Only) as on 31.12.2022 due to Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch with subsequent interest and expenses

Sr.	Brief Description of the Property		EMD	
On equitable mortgage of undivided share in land and commercial buildir No. B-109 constructed thereat to the extent of 418.00 Sq. fts or 38.8 (Super built up area) and 264.58 Sq.ft or 24.59 Sq.mtrs (Built up area) carpet area admeasuring 247.58 Sq. ft or 23.01 Sq.mtrs on 1st floor of no. B at "Mark Point" constructed on the land bearing Final Plot No. 1 Scheme No. 69 (Godadara-Dindoli) Block No. 203, Revenue Survey No of village: Dindoli, Sub-dist. Surat City, Dist. Surat standing in the n Harsukhbhai Laljibhai Vaghasiya. Boundaries: South: Staircase, Nort No-B-110, East: Shop No-B-108, West: Pratik Residency			1,08,000/-	
2	On equitable mortgage of undivided share in land and commercial building shop No. C-021 constructed thereat to the extent of 700.00 Sq. fts or 65.05 Sq.mt (Super built up area) and admeasuring 386.06 Sq. ft or 35.88 Sq.mtrs		2,66,000/-	

(Built up area) and its carpet area admeasuring 378.85 Sq. ft or 35.21 Sq.mtrs on Ground floor of building no. C at "Mark Point" constructed on the land bearing Final Plot No. 173, T.P Scheme No. 69 (Godadara-Dindoli) Block No. 204 Revenue Survey No. 128/1 of village: Dindoli, Sub-dist. Surat City, Dist. Surat standing in the name of Harsukhbhai Laljibhai Vaghasiya. Boundaries: South Passage, North: Shop No-C-22, East: Shop No-C-20, West: Staircase

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in) **Authorised Officer**

Date: 31.01.2023

Tamilnad Mercantile Bank Ltd **Ahmedabad Regional Office** (For Ringroad Branch)

GUJARAT TERCE LABORATORIES LIMITED Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat)

Phone:- 079 - 41005079, CIN NO: L24100GJ985PLC007753 email: gtll.factory@gmail.com website:www.gujaratterce.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2022.

	STANDALONE	[RS.IN LAKHS	EXCEPT PER SI	HARE DETAIL]
Sr. No.	Particulars	Quarter ended 31.12.2022 Unaudited	Quarter ended 31.12.2021 Unaudited	Year ended 31.03.2022 Audited
1	Income			
	a) Revenue from operations (Net)	1,190.48	1,074.60	4,013.37
	b) Other income	8.43	6.97	30.60
2	Net Profit / (Loss) for the period (before Tax,			
	Exceptional and/or Extraordinary items)	-0.28	55.21	74.66
3	Net Profit / (Loss) for the period before Tax			
	(after Exceptional and/or Extraordinary items)	-0.28	55.21	74.66
4	Net Profit / (Loss) for the period after Tax			
	(after Exceptional and/or Extraordinary items)	-0.28	47.71	87.23
5	Total Comprehensive Income for the period			
	[Comprising Profit /(Loss) for the period (after tax)			
	and Other Comprehensive Income (after tax)]	-0.28	47.71	87.23
6	Paid up Equity Share Capital	742.03	742.03	742.03
7	Reserves (excluding Revaluation Reserve)	-136.10	266.57	111.40
8	"Earnings Per Share (of Rs.10/- each)			
	(for continuing and discontinued operations) -			
	1. Basic:	-	0.64	1.18
	2. Diluted:"			

1 The above unaudited results have been reviewed by Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 31.01.2023. The Statutory Auditors have carried out limited review of the financial results for the quarter and nine months ended on 31st December, 2022

The Above unaudited results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as modified by Circular dated August, 10, 2016

The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on December 31, 2022 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The full format of standalone financial results are available on the website of BSE at www.bseindia.com and on company's website www.gujaratterce.in.

Place: Ahmedabad Date: 31.01.2023

By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited

Aalap Prajapati (Managing Director and CEO) DIN: 08088327

Aadhar Housing Finance Ltd

Aadhar Housing Finance Ltd. Corp.Off.: Unit No. 802, Natraj Rustomiee Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai – 400069

CORRIGENDUM

Please refer advertisement of **PUBLIC** NOTICE FOR AUCTION CUM SALE published in this Newspaper on 31.01.2023 of Borrower Kishorkumar Ramprasad Basita, Auction has beer withdrawn due to technical reason.

Sd/- Authorised Officer

#BSBankingShow

IN TOMORROW'S EPISODE



Büsiness Standard **BANKING** SHOW

Thursdays | 11am



How will a five-day work week affect banking, and would it save costs?

Banking Unlocked



Visit mybs.in/BankingShow or scan this code to watch

Business Standard

business.standard bsindia

Insight Out

business-standard.com

DB (INTERNATIONAL) STOCK BROKERS LTD. Regd. Office: Unit No. 210/211/211A at 2nd floor, Dalal Street Commercial Cooperative Society Ltd, Block No. 53, Zone 5, Gift City, Gandhinagar, Gujarat-382355 CIN: L67120GJ1992PLC121278 Tel No: 011-43606162

Notice is hereby given that pursuant to Regulation 29 and 47 of the SEBI (LODR) Regulations, 2015, Board Meeting (BM-6) is scheduled to be held on Wednesday, 08th February, 2023 at 04:00 P.M. at its Corporate Office at 114, New Delhi House, 27 Barakhamba Road, New Delhi-110001 to consider inter-alia Un-Audited Standalone and Consolidated Financial Statements for the Third Quarter and Nine Months ended 31 December, 2022 and other matters as decided by the board. The said notice may be accessed on the company's website at www.dbonline.in and also on NSE and BSE website

By order of the Board For DB (International) Stock Brokers Ltd.

Pragya Singh Date: 31.01.2023 Company Secretary Place: New Delhi and Compliance Office

Tamilnad
Mercantile
Bank Ltd CIN - U65110TN1921PLC001908

Ponerty No 1

Tamilnad Mercantile Bank Limited

Ringroad Branch:

Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh House, Kinnary Cinemas, Ringroad Branch, Surat - 395002, Gujarat

Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

AUCTION NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provison to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) M/s.Krish Enterprise, Proprietor Mr.Thummar Nareshbhai Dhirubhai, S/o. Mr.Dhirubhai Lakhamanbhai Thummar and the Guaranto Mr.Sitapara Ashwin Vallabhbhai, S/o.Mr.Vallabhbhai Lavjibhai Sitapara that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the constructive possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch, (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 20.02.2023, for recovery of Rs.1,28,62,086.59 (Rupees One Crore Twenty Eight Lakhs Sixty Two Thousand Eighty Six and Paise Fifty Nine Only) as on 31.12.22 due to Tamilnad Mercantile Bank Limited, Ringroad Branchwith subsequent interest and expenses.

The Reserve Price for property No.1 will be Rs.24,50,000/- and the earnest money deposit will be Rs.2,45,000/-The Reserve Price for property No.2 will be Rs.12,00,000/- and the earnest money deposit will be Rs.1,20,000/-The Reserve Price for property No.3 will be Rs.12,00,000/- and the earnest money deposit will be Rs.1,20,000/-

> **DETAILS OF AUCTION** On Equitable Mortgage of All that right title and interest in Shop No.B-102 Super built

Poperty No.1	up area admeasuring 850.00sq.fts or 78.99sq.mt and its built up area admeasuring 549.19sq.ft or 51.04sq.mtrs and its Carpet area admeasuring 549.19sq.ft or 51.04sq.mtrs and its Carpet area admeasuring 508.84sq.ft or 47.29sq.mtrs on 1st floor of Building No.B at "Mark Point" constructed on the land bearing Final plot No.172, T.P.Scheme No.69 (Godadara-Dindoli) Block No.203, Revenue Survey No.128/2 of Village: Dindoli, Taluk Choryasi, Sub-dist.Surat City, Dist.Surat stands in the name of the name of Nareshbhai Dhirubhai Thummar. Boundaries: North by: Passage, South by: Building No-A, East by: Shop No-B-101, West by: Pratik Residency
Reserve Price	Rs.24,50,000/-
Poperty No.2	On Equitable Mortgage of All that right title and interest in Shop No.B-103 Super built up area admeasuring 418.00sq.ft or 38.84sq.mt and its built up area admeasuring 266.74sq.ft or 24.79sq.mtrs and its Carpet area admeasuring 250.06sq.ft or 23.24sq.mtrs on 1st floor of Building No.B at "Mark Point" constructed on the land bearing Final plot No.172, T.P.Scheme No.69 (Godadara-Dindoli) Block No.203, Revenue Survey No.128/2 of Village: Dindoli, Taluk Choryasi, Sub-dist.Surat City, Dist.Surat stands in the name of the name of Nareshbhai Dhirubhai Thummar. Boundaries: North by: Shop No-B-104, South by: Staircase, East by: Passage, West by: Pratik Residency
Reserve Price	Rs.12,00,000/-
Poperty No.3	On Equitable Mortgage of All that right title and interest in Shop No.B-104 Super built up area admeasuring 418.00sq.fts or 38.84sq.mt and its built up area admeasuring 266.74sq.ft or 24.79sq.mtrs and its Carpet area admeasuring 250.06sq.ft or 23.24sq.mtrs on 1st floor of Building No.B at "Mark Point" constructed on the land bearing Final plot No.172, T.P.Scheme No.69 (Godadara-Dindoli) Block No.203, Revenue Survey No.128/2 of Village: Dindoli, Taluk Choryasi, Sub-dist.Surat City, Dist.Surat stands in the name of the name of Nareshbhai Dhirubhai Thummar. Boundaries: North by: Shop no-B-105, South by: Shop no-B-103, East by: Passage, West by: Pratik Residency
Reserve Price	Rs.12,00,000/-
For detailed terms and cond	ditions of the sale, please refer to the link provided in secured creditors website

(www.tmb.in) **Authorised Officer**

Place: Ringroad, Surat.

Date: 31.01.2023



Tamilnad Mercantile Bank Ltd

Ahmedabad Regional Office

(For Ringroad Branch)













સંસદના બજેટસત્રનો પ્રારંભઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રથમ સંબોધન

દેશમાં આજે નિડર અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખનાર સરકાર: દ્રૌપદી મુર્મુ

દેશ આજે આઝાદીના આજે ગરીબી હટાવો ફકત એક સૂત્ર ઈચ્છાશક્તિ દર્શાવાઈ છે. તેઓએ પણ આગળ ધર્યો હતો અને વિકાસની ઉકેલે છે. રાષ્ટ્રપતિના ભાષણને આજે અમૃતકાળમાંથી પંચપ્રાણમની પ્રેરણા નહી પરંતુ તે કાર્યરત થઈ ગયું છે સર્જીકલ સ્ટ્રાઈક તથા ચીન સાથેની લઈને આગળ વધી રહ્યો છે અને

ગુલામીના દરેક નિશાન, દરેક માનસીકતાથી મુક્તિ અપાવવા માટે મારી સરકાર નિરંતર કાર્યરત છે. એક સમયે જે રાજપથ હતો તે આજે કર્તવ્યપથ બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રના તેમના પ્રથમ સંબોધનમાં 🌗 જણાવ્યું હતું કે આપણી વિરાસત બજેટસત્રમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી અને દેશહિતને સર્વોપરી રાખનાર કર્યો હતો. આત્મનિર્ભર ભારત તેમજ



આપણા જડ સાથે આપણને જોડે સર્જાઈ હતી તેમાં ગરીબી રેખાથી

મોદી સરકારની વિવિધ ઉપલબ્ધીઓને આગળ ધરતા રાષ્ટ્રપતિઃ શાસક પક્ષ દ્વારા પાટલીઓ થપથપાવી અભિવાદનઃ વિપક્ષની સાંસદોએ દખલગીરી કરવાનો નિષ્કળ પ્રયાસ કર્યો

આઈએમએફનું વિશ્વ અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મહત્વનું નિવેદન

ભારતની અર્થવ્યવસ્થા ત્રિમાસિક

ઇન્ટરનેશનલ મોર્નેટરી ફંડ ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.

અને તે ૩.૦ટકા સુધી પહોંચી શકે

ટકાની વૃદ્ધિ

નોંધાઈ શકે છે.

ગાળામાં સૌથી ઝડપથી વિકસતી હોઈ

પાછળના વર્ષ કરતા ઘટાડો એશિયામાં પ.૩ ટકા અને પ.૪

દ્વારા આજે વિશ્વની અર્થવ્યવસ્થા ક્વાર્ટરમાં ૬.૮ ટકાના દરે વધી

અને ભારતીય અર્થવ્યવસ્થાને રહી છે, જે આગામી નાશાકીય

લઈને મહત્વનું નિવેદન આપ્યું વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દ.૧ ટકા

છે. વિશ્વ અર્થવ્યવસ્થાના રહેવાની શક્ચતા છે.

સંદર્ભમાં, આઈએમએફએ કહ્યું છે આઈએમએફના રિપોર્ટ અનુસાર,

કે,વર્ષ૨૦૨૩માં **વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક વૃદ્ધિમાં** વર્ષ૨૦૨૩અને વૈશ્વિક વૃદ્ધિમાં **વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક વૃદ્ધિમાં** ૨૦૨૪મા

નોંધવાની સંભાવના

આઈએમએફઅનુસાર, વર્ષ એવું પણ કહેવાય રહ્યું છે કે,

૨૦૨૩માં વિશ્વની અર્થવ્યવસ્થા એશિયાનો વિકાસ ચીનના વિકાસ

૨.૯ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. પર નિર્ભર રહી શકે છે. ૨૦૨૨

વર્ષ ૨૦૨૨ માં, તેનો અંદાજ ૩.૪ માં, ચીનમાં ઝીરો કોવિડ નીતિને

ટકા હતો. બીજી તરફ, વર્ષ કારણે, જીડીપીમાં ભારે ઘટાડો

૨૦૨૪ વિશે એક સારો અંદાજ નોંધાયો હતો અને તે ૪.૩ ટકા

લગાવાઈ રહ્યો છે કે, વિશ્વની પર પહોંચ્યો હતો. ચીનમાં,

અર્થવ્યવસ્થામાં ફરીએકવાર તેજી જાન્યુ આરી અને માર્ચવચ્ચે

જોવા મળી શકે છે અને તે ૩.૧ જીડીપીમાં ઘટાડો નોંધાઈ શકે છે

વાત કરીએ તો આ ત્રિમાસિક ૪૦ વર્ષમાં ચીનનો જીડીપીવિશ્વ

ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા અર્થવ્યવસ્થાના વિકાસ કરતાં

વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઓછો નોંધાયો છે. ચીનની

વૈશ્વિક સ્તરે કોમોડિટીના વધતા ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ વધુ વધી શકે છે

દેશમાં ડીકાર્બનાઇઝેશન માટે રાષ્ટ્રીય

ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી

મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ

૨૦૨૨-૨૩માં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે કોમોડિટીના વધતા

ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ વધુ વધી શકે છે. માટે તેના પર

ચાંપતી નજર રાખવાની જરૂર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા

જો ભારતની અર્થવ્યવસ્થાની છે. આ પ્રથમ વખત છે કે છેલ્લા

પાછળનાં વર્ષ

કરતા ઘટાડો

નાેં ધવાની

સંભાવના છે.

ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.

જવાબનો ઉદ્ઘેખ કર્યો હતો અને ઉમેર્યુ કે મારી સરકારે કલમ ૩૭૦ની નાબુદીથી લઈ ત્રીપલ તલાક સહિતના મુદ્દાઓ પર આકરુ વલણ અપનાવીને કામ કર્યુ છે. દ્રૌપદી મુર્મુએ સ્વીકાર્યુ કે ભ્રષ્ટાચાર એ લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે અને તેથી જ સરકારની ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ ચાલુ છે. તેઓએ છે અને મારી સરકાર તેને મજબૂત નીચે લોકોને જતા બચાવવામાં મારી પોતાના પ્રથમ પ્રવચનમાં લોકોને જે બનાવવા માટે પ્રાથમીકતા આપે છે. સરકાર સફળ રહી હતી. શ્રી મુર્મુએ કોરોનાકાળથી મફતમાં અનાજ લગભગ બે માસ ચાલનારા સંસદના જણાવ્યું કે ભારતમાં આજે નિડર આપવામાં આવી રહ્યું છે તેનો ઉદ્ઘેખ

केंगर। अंड 📣 Canara Bank

સાબરમતી શાખાઃ

8)d. 8238091918 / 99244 44482

ગારૂતિ સુઝુકી EECO TOUR V 5 Seater AC

(મૉલિક : સત્યારથી નિલમ સિંઘ) (રજીસ્ટ્રેશન નંબર GJ01HT6345) વેચવાની છે

રસ ધરાવાનો તેમની ઓકર સીલબંધ કવરમાં તા. ૦૮.૦૨.૨૦૨૩, સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ઉપરોક્ત જણાવેલ શાખાને મોકલી આપવી. ગાંકી નિરીક્ષણ માટે ઉપરોક્ત શાખાનો તા. ૦૬.૦૨.૨૦૨૩ ના

ઉપરાક્ષત શાખાનો તો. 09.02.૨૦૨૩ નો બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ દરમ્યાન સંપર્ક કરી શકાશે. વેચાણ માટે સૌથી વધુ ભાવપત્રક માન્ય ગણાશે. બેંકનો નિર્ણય આખરી રહેશે અને તમામ પાર્ટીઓને બંધનકર્તા રહેશે.

જાહેર નોટીસ

આથી અમો જાહેર નોટીસ આપી

જાણ કરીએ છીએ કે, કંચનધારા

એસ્ટેટ ઓનર્સ એસોશીએશન

(પૂજન એપાર્ટમેન્ટ) ૧૮, મોતીનગર

સોસાયટી, પાલડી, અમદાવાદ-

૩૮૦૦૦૭ (રજી. નંબર NTC/G

3652 તા. ૨૮-૧-૧૯૯૧) ના ફ્લેટ

નંબર 302ના માલિક એ. જે. ડૉકટર,

ડી.એ. ડૉકટરનો રૂપિયા ૨૫૦/- ના

શેર સર્ટીફિકેટ નંબર ૧૨, શેર લેજર ફોલીઓ નંબર ૨ નું અસૂલ શેર

સર્ટીફિકેટ સભ્યશ્રીથી ખોવાઈ ગયેલ છે. જેનું ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ

આપવા બાબતે કોઈ પણ વાંધો હોય

તો સોસાયટીના ચેરમેન/ સેક્રેટરીને દિન-૭ (સાત)માં લેખિત જાણ કરવી.

કંચનધારા એસ્ટેટ ઓનર્સ એસોશીએશન

(પૂજન એપાર્ટમેન્ટ), ૧૮, મોતીનગર

ચેરમેન/ સેક્રેટરી

ભારત હવે એ સ્થિતિમાં આવી ગયો વધાવી લેવામાં આવ્યો હતો.

બાબતમાં પણ સરકાર ગંભીર છે તે સંસદમાં શાસક પક્ષ દ્વારા તાળીઓના સરહદ પર ભારતીય સૈન્યએ આપેલા સ્પષ્ટ કર્યુ હતું, રાષ્ટ્રપતિએ ઉમેર્યુ કે ગડગડાટ અને પાટલી થપથપાવીને



બેંક ઓફ મહારાષ્ટ્ર ઘાટલોડીયા શાખા, અમદાવાદ

આધી વિખ લિખિત વ્યક્તિઓને નોટિસ આપીને જણાવવાનું કે તેઓ તેમના લોન એકાઉન્ટમાં બાકી લેણાં ભરપાઇ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેમને પાઠવેલી નોટિસો તેમને બજ્યા વગર બંકને પરત મળેલ છે. આથી તેઓને વિનંતી કરીને જણાવવાનું કે તા. 6 ન્વર-૧૦૨૩ પહેલાં તેમને બાકી લેણાં અને અન્ય ખર્ચ વગેર અફવી કે અને પોતાની પ્લેજમાં મુકેલી સિક્યોરિટી છોડાવી દે. તેમ કરવામાં નિષ્ફળ નીવડશો તો સુચિત ક્રિક્યોરિટી છે તારીએ અને અને ખર્ચ બેંકના પ્રિમાદીની સિક્યોરિટી છોડાવી દે. તેમ કરવામાં નિષ્ફળ નીવડશો તો સુચિત ક્રિક્યોરિટી છે તારીએ અને ૦૦ ને ૨૦ ર ૨૦ ર તો જ અણકતીના ખર્ચ બેંકના પ્રિમાદીનીસ – શોપ નં. ૧૪, ૧૫, ૧૧, સત્યા-૨, ૨ન્ના પાર્ક સેડ, થોટલોડીયા, એમદાવાદ-૩૮૦૦૧ લખો સવારે ૧૧,૦૦ વાગે અથવા તે પછીની અનુકળ તારીખે બેંકની સંપૃણે મૃનસુકી પર આગળની સ્થાન ઉપલબ્ધ હેર હત્યુ જો યુંકને તેને વચાણ કરતો, સોનાના આણેપણેની

લોનની તારીખ	લोन ખાતા नं.	ૠણકર્તાનું નામ અને સરનામું	હરાજી માટે અનામત કિંમત
59/40/5054	60398354437	શ્રી અંકિતકુમાર ગુપ્તા જે ૬૦૭ ભાગ-૪, ઉમંગ નગર, વક્ષ્મીનગર પારો, જૂની નારોલ કોર્ટની પાછળ, નારોલ, અમદાવાદ-૩૮૨૪૦૫	-/٥٥٥, ٩٤, ۶

torrent-POWER

ટોરેન્ટ પાવર લિમિટેડ नोटीस

માહકોને ગુજ્ઞવત્તાભર્યો અને વિશ્વસનીય વીજપૂરવઠો સતત અને સુનિશ્ચિતપન્ને મળતો રહે તે માટે નેટવર્ક મેઇનટેનન્સનું આયોજન કરેલ છે. નીચે દર્શાવેલ સબસ્ટેશનો/પોલ માઉન્ટેન્ડ ટ્રાન્સફોર્મરમાંથી વીજપૂરવઠો મેળવતા પ્રાહકોનો સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન વીજપૂરવઠો બંધ થવાની શક્યતા છે. આપની પ્રવૃત્તિઓનું આયોજન તે મુજબ કરવા વિનંતી.

<u>તા.૦૩/૦૨/૨૦૨૩, શુક્રવારઃ (૧) નિકોલઃ</u> કર્ણાવતીનગર (નિકોલ)-SS, (૨) <u>સેક્ટર-૧૪ઃ</u> સર્વે ટ્રેઇનીગ ઇન્સ્ટીટ્યુટ-SS, (૩) <u>વિંઝોલઃ</u> સિધ્ધાર્થ એસ્ટેટ-TR, (૪) <u>અમરાઇવાડીઃ</u> તલાવડીના છાપરા S/S નં.૧-TR-૧, (૫) <u>થલતેજ થી ઈસકોન એસ.જી. હાઈવેઃ</u> સર્કલ-બી-SS, (€) <u>ગુજરાત</u> યનિવર્સિટી: સ્ટેટિસ્ટીક્સ-TR. તા.0૪/0૨/૨૦૨૩. શનિવાર: (૧) અમરાઇવાડી: રામેશર એસ્ટેટ-TR, (૨) <u>પિરાણા:</u> ક્લગિધર-(DIST)-TR, (૩) <u>ક્રોમર્સ ક્રોલેજ રોડ:</u> ૩૨૩ કોર્પોરેટ-SS.

અસુવિદ્યા બદલ દિલગીર છીએ

RO JEWELS LIMITED

CIN: U7499GJ2018PLC105540 Ground Floor, Hallmark 4 Complex, Harl Bhaktl ni Pole, Opp. B.D. College, Shankd Sheri, Manekchowk, Ahmedabad - 380001 Gujarat, India. Phone No.: 07922144429 Emall: compliancerojewels@gmail.com Website: www.rojewels.co.in NOTICE OF POSTAL BALLOT

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given that pursuant to Section 110 read with Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013, ('Act') (Including any statutory modification or re-enactment thereof for the time being in force), read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, ('Rules'), Regulations (Secretarial Standard on General Meetings issued by The Institute of Company Secretaries of India (SS-2'), each as amended, and in accordance with the requirements) ('SS-2'), each as amended, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ('MCA') for holding extraordinary general meetings / conducting postal ballot process through e-voting vide General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 stated June 15, 2020, 33/2020 dated September 28, 2022, 33/2020 dated September 28, 2022, 33/2020 dated September 28, 2022, 35/2020 dated May 5, 2022 and 11/2022 dated December 31, 2022 (Sauded December 32, 2021, 20/2022 dated May 6, 2022 and 11/2022 dated December 32, 2022, 10/2022 dated May 5, 2022 and 11/2022 dated December 32, 2021, 20/2022 dated May 6, 2022 and 11/2022 dated December 32, 2022, 10/2022 dated May 6, 2022 and 11/2022 sissued by the Ministry of Corporate Affairs (MCA) (hereinafter collectively referred to as 'MCA Circulars'), the approval of the members of RO Jewels Limited (the 'Company') is being sought for Stock Spilt / Sub-Division of Equity Shares of the Company from the face value of Rs. 10/- to face value of Rs. 2/- per share and Alteration of Capital Clause of Memorandum of Association on account of Spilt/ Sub-Division of tequity shares of the company, through postal ballot by volting through electronic means (remote e-voting) only.

The Postal Ballot Notice, explanatory statement and e-voting instructions, have been sent by the company through electronic med on Tuesday, 31st January.

Voting through electronic means (remote e-voting) only.

The Postal Ballot Notice, explanatory statement and e-voting instructions, have been sent by the company through electronic mode on Tuesday, 31st January, 2023 only to those Members whose e-mail addresses are registered with the Company / Depositories as on Friday, 27th January, 2023 (cut-off date). The voting rights of the members shall be in proportion to the shares held by them in paid-up equity share capital of the company as on cut-off date. Any person who is not a Member as on the cut-off date should treat this Notice for information purposes only. The Notice has also been made available on the website of the Company at http://rojewels.co.in/, website of Stock Exchange le, 85E Limited at www.bseindia.com and on the website of NSDL at www.voting.nsd.com at www.osendia.com and on the website or NSUL at www.ostinig.nsdi.com
The Company has engaged the services of NSDL to provide remote e-votin
facility. The remote e-voting shall commence from 09:00 a.m. (IST) or
Wednesday, 1st February, 2023 and ends at 5:00 p.m. (IST) on Thursday, 2n
March, 2023. E-voting shall not be allowed beyond 5:00 pm. (IST) on to
Thursday, 2nd March, 2023 and the e-voting module shall be disabled by NSD
and members will not be allowed to vote thereafter.

The results of the postal ballot will be announced on or before 5.00 p.m. (IST) Saturday, March 04, 2023 and will be uploaded on the website of the Compan and will be communicated to Stock Exchange i.e. BSE Limited where Equit Shares of the Company are listed.

ANOUAMINI REALINGS RETURNING OF DEPARTMENT OF DEPARTMENT OF THE COURT OF THE COURT

To,

1. Mr. H. Tribhuvan Patel
Proprietor M/s Gurudev Holding
2. Mr. Aaksah Tribhuvan Patel
S/o H. Tribhuvan Patel,
Authorised Signatory M/s Gurudev Holding
Both at: T-1A, Triputi House,
Near GIDC VIS Negar, Gujaratika Unjha,
District Mehsena, Gujarat

District Mehsana, Gujarat
WHEREAS you are intentionally
evading the service of summons of the
court, it is hereby notified that if you shall
not defend the case on the 25-02-2023,
the day fixed for the final disposal, it will be
heard and determined ex-parte. GIVEN under my hand and the seal of the court, this 04-01-2023. Addl. District Judge-4 (N/W)

Rohini Courts, Delhi

PROCLAMATION REQUIRING ATTENDANCE OF DEFENDANT (ORDER 5, rule 20 of the Code of Civil Procedure In the court of Sh. Sunil Chaudhary Addl. District Judge-4 (N/W) Room No. 212, 2nd Floor, Rohini Courts, Delhi

Suit No. : CSDJ-653/21 Kuldeep Dhingra Versus H. Tribhuvan Patel

... Mr. H. Tribhuvan Patel roprietor M/s Gurudev Holding Mr. Aakash Tribhuvan Patel O H. Tribhuvan Patel, uthorised Signatory M/s Gurudev Holding oth at: 1-14, Tripul House, ear GIDC VIS Nagar, Gujarat sos at: Village Ranchor Pura, Taluka Unjha, istrict Mehsana, Gujarat WHEREAS, vou am Intentionally

Unsurct Mensans, Gujarat
WH-IERAS you are intentionally
evading the service of summons of the
court, it is hereby notified that if you shall
not defend the case on the 25-02-2023,
the day fixed for the final disposal, it will be
heard and determined ex-parte.
GIVEN under my hand and the seal of the
court, this 04-01-2023.
Sg/

गूषरात विधापीह, समहावाह - उ८०००६ <u>टेन्डर नोहिस GV/PV/1-2/2023-24</u>

ગૂજરાત વિદ્યાપીઠમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમિયાન ઉત્તરવહી અને પુરવણી છપાવવા માટે તથા સ્ટેશનરી ખરીદ અંગે ભાવ મંગાવવામાં આવે છે. અન્ય વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. Website :- www.gujaratvidyapith.org

and www.nprocure.com તા. ૦૧/૦૨/૨૦૨૩ છેલ્લી તા. ૨૧/૦૨/૨૦૨૩ કા. કુલસચિવ

K.Z. LEASING AND FINANCE LIMITED CIN: L65910GJ1986PLC00864 Regd. Office: Deshna Chambers, Bh. Kadwa Patidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone: (079) 27543200 EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED ON 31TH DECEMBER, 2022. (Rs. in Lacs)

Sr No. Particulars	Quarter ended on 31/12/2022 (Unaudited)	Quarter ended on 31/12/2021 (Unaudited)	Nine Months ended on 31/12/2022 (Unaudited)
1 Total Income from Operations 2 Net Profit / (Loss) for the period (before Tax, exceptional and /	61.55	88.74	154.69
or extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after exceptional	32.45	61.63	70.63
and / or extraordinary items)	32.45	9.01	70.63
4 Net Profit / (loss) for the period after tax	32.45	9.01	57.03
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (loss) for the period (after tax) and other	************		
comprehensive Income (after tax)	121.26	(5.63)	(43.39)
6 Paid-up Equity Share Capital	304.12	304.12	304.12
7 Reserves (excluding Revaluation reserve as shown in the Balance		2000	
Sheet of Previous year) 8 Earnings per Share (of Rs.10/- each) (for continuing & discontinued operations)			
- Basic and Diluted	1.07	0.30	2.32

approved by the Board of Directors in the meeting held on 31/01/2023 (3) The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2019. Accordingly the Financial Result for the Quarter ended on 31th December, 2022 are in accordance with IND-AS and other accounting principles generally accepted in India. (4) Exceptional and / or Extraordinary items adjusted in the Statement of Profit accoss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable. Date: 31/01/2023 For, K.Z. Leasing and Finance Ltd.

medabad sd/- Pravinkumar K. Patel (DIN - 00841628

GUJARAT TERCE LABORATORIES LIMITED Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat) Phone:- 079 - 41005079, CIN NO: L24100GJ985PLC007753 email: gtll.factory@gmail.com website:www.gujaratterce.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2022. [RS.IN LAKHS EXCEPT PER SHARE DETAIL] 31.12.2022 31.12.2021 31.03.2022 Unaudited Unaudited a) Revenue from operations (Net) 1.190.48 1.074.60 4.013.37 b) Other income 30.60 8.43 6.97 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) -0.28 55.21 74.66 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) -0.28 55.21 74.66 Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items) -0.2847.71 87.23 Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss) for the period (after tax) 47.71

. Basic 2. Diluted

and Other Comprehensive Income (after tax)]

Reserves (excluding Revaluation Reserve)

(for continuing and discontinued operations)

"Earnings Per Share (of Rs.10/- each)

Paid up Equity Share Capital

The above unaudited results have been reviewed by Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 31.01.2023. The Statutory Auditors have carried out limited review of the financial results for the quarter and nine months ended on 31st December, 2022

-0.28

742.03

-136.10

The Above unaudited results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as modified by Circular dated August, 10, 2016

The above is an extract of the detailed format of Financial Results for the guarter ended on December 31, 2023 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015 The full format of standalone financial results are available on the website of BSE at www.bseindia.com and or company's website www.gujaratterce.in.

By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited Sd/-

742.03

266.57

0.64

87.23

742.03

111.40

1.18

Aalap Prajapati DIN: 08088327

મુજબ સપ્ટેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ વધીને સોસાયટી, પાલડી, અમદાવાદ-૭ જીડીપીના ૪.૪ ટકા આ મિશન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં થઈ ગઈ છે. એપ્રિલ-ગ્રીન હાઇડ્રોજનની ડિમાન્ડ જનરેશન, યુઝ જૂનુ ક્વાર્ટરમાં તે જીડીપીના ૨.૨ ટકા અને એક્સપોર્ટની સુવિધા આપવામાં હતો.

२०२२-२3

માટેના આર્થિક

રોકાણ પણ લાવવામાં આવશે સર્વેક્ષણમાં જણાવાયું છે કે, રિકવરીને વેગ આપવામાં આવ્યો છે, જે મોટાભાગે સ્થાનિક માંગમાં વધારો અને મોટા પ્રમાણમાં નિકાસ દ્વારા સંચાલિત છે, જે ચાલુ ખાતાના સંતુલનના જોખમોમાં વધારો કરે છે. આવી સ્થિતિમાં ચાલુ નાણાકીય વર્ષનો વૃદ્ધિદર ાગામી વર્ષ સુધી જઈ શકે તેમ હોવાથી ચાલુ ખાતાની ખા' પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના ક્લાઇમેટ સંબંધિત કાર્યવાહીમાં નાણાનો અભાવ સતત સમસ્યા બની રહ્યો છે. અમે હજી સુધી મોટા પાયે ઘરેલું સ્રોતોથી અમારી બધી જરૂરિયાતોને પૂર્ણે કરી છે. હવે ખાનગી મૂડી ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, સાથે જ આ માટે સોવરેન ગ્રીન બોન્ડની જેમ કામ કરે છે, સરકાર

આવશે અને ૮ લાખ કરોડ રૂપિયાથી વધુનું

પણ કામ કરી રહી છે. ભારતની આ પહેલ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ નોંધપાત્ર છે. દેશ વૈશ્વિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે કામ કરી રહ્યો

વૈકલ્પિક બળતણ તરીકે હાઇડ્રોજન એક સારો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આને ડિકાર્બનાઇઝેશનની તક તરીકે જોવામાં આવી રહ્યું છે. જે દેશ માટે ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસનું મોટું પરિબળ બની શકે છે. તે ખાતર, રિફાઇનિંગ, મિથેનોલ, દરિયાઇ પરિવહન, લોખંડ અને સ્ટીલ તેમજ લોગ હોલ પરિવહન જેવા ક્ષેત્રોમાં ડીકાર્બનાઇઝેશન પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દેશને ઉર્જા સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માટે, ડીકાર્બનાઇઝેશન તરફ સતત કામ કરવામાં આવી રહ્યું છે અને ૪ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ, ૧૯૭૪૪ કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રીન હાઇડ્રોજનની ડિમાન્ડ જનરેશન, યુઝ અને એક્સપોર્ટની સુવિધા આપવામાં આવશે અને ૮ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાશ પણ લાવવામાં આવશે.

GHCL

જીએચસીએલ લિમીટેડ

Place: Ahmedabad

રજીસ્ટર્ડ એફીસ : જીએચસીએલ હાઉસ, પંજાબી હોલ સામે, નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે, નવરંગપુરા, અમદાવાદ-3૮000લ. ગુજરાત. Phone : 079-26434100, Fax: 079-26423623 Email: ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in, Website: www.ghcl.co.in, (CIN: L24100GJ1983PLC006513)

3૧મી ડિસેમ્બર. ૨૦૨૨ ના રોજ પરા **થ**યેલા ત્રિમાસિક અને નવમાસિક ગાળાના ઓડીટ વગરના અનમાનિત નાણાંકીય પરિણામો

							(રૂા. કરોડમાં
			પૃથક			સંગઠિત	
5 이.	વિવરણ	પૂરા થયેલ ત્રિમાસિક	પૂરા થયેલ નવમાસિક	પૂરા થયેલ ત્રિમાસિક	પૂરા થયેલ ત્રિમાસિક	પૂરા થયેલ નવમાસિક	પૂરા થયેલ ત્રિમાસિક
ө.	1110	31.12.2022	31.12.2022	31.12.2021	31.12.2022	31.12.2022	31.12.2021
			ઓડીટ વગરના				
٩	ચાલુ કામગીરીમાંથી થચેલ કુલ આવક	9,226.82	¥,040.00	1,009.39	૧,૨૮૯.૫૯	¥,040.¥¥	9,009.03
5	ચાલુ કામગીરીમાંથી થયેલ અને નાણાંકીય કોસ્ટ પછીનો અપવાદરૂપ બાબતો પહેલાનો ચોખ્ખો નફો	79.9EE	1,116.80	203.35	332.28	1,116.86	209.32
3	ચાલુ કામગીરીમાંથી થયેલ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો (અપવાદરૂપ અને /અથવા અસામાન્ય બાબતો પછીનો)	332.64	1,153.16	205.35	335.28	1,123.48	209.32
R	ચાલુ કામગીરીમાંથી થયેલ કરવેરા પછીનો ચોખ્ખો નફો (અપવાદરૂપ અને /અથવા અસામાન્ય બાબતો પછીનો)	૨૪७.૫૯	૮७૫.૨૯	૧૫૨.૯૧	280.56	262.91	૧૫૨.૯७
ч	બંધ કામગીરીમાંથી થચેલ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો	_	۷.8٩	93.66	2.22	1.56	13.30
g	બંધ કામગીરીમાંથી થયેલ કરવેરા પછીનો ચોખ્ખો નફો		9.86	10.38	2.22	(0.28)	6.69
6	ચાલુ અને બંધ કામગીરીમાંથી થયેલ સમયગાળાનો કુલ નફો	૨૪७.૫૯	261.65	193.24	૨૫૦.૫૬	262.30	192.22
6	અન્ય સમાવિષ્ટ આવક	1.41	0.68	(૧.૫૬)	1.34	0.01	(1.42)
e	કુલ સમાવિષ્ટ આવક (કરવેરા પછીની)	२४ 6.10	૮૮૨.૫૨	191.96	૨૫૧.૯૧	262.32	191.30
10	ભરપાઈ થચેલ ઈક્વિટી શેર મૂકી (દરેક શેરનું દર્શન મૂલ્ચ રૂા. ૧૦/–)	૯૫,૫૯	૯૫.૫૯	GU.3 U	૯૫.૫૯	૯૫.૫૯	૯૫.૩૫
99	ઓડીટ થયેલ બેલેન્સ શીટ મુજબ પુનઃમૂલ્યાંકન ભંડોળ સિવાયની શેર મૂડી	-	-	-		-	-
45	શેર દીઠ કમાણી (રૂા. ૧૦/– ના શેર દીઠ)		બિન-વાર્ષિક		બિ ન −વાર્ષિક	બિ ન−વાર્ષિક	
	(ક) મૂળભૂત – ચાલુ કામગીરીમાંથી	રપ.૯૨	69.52	15.04	૨૫.૯૩	G¥.09	15.00
	(ખ) તરલીકૃત – ચાલુ કામગીરીમાંથી	રપ.૯૩	61.50	18.02	રપ.૯૪	ev.11	15.02
	(ગ) મૂળભૂત – બંધ કામગીરીમાંથી	-	0.92	1.06	0.30	(0.03)	1.08
	(ઘ) તરલીકૃત – બંધ કામગીરીમાંથી	-	0.92	9.02	0.30	(0.03)	9.08
	(ચ) મૂળભૂત – ચાલુ અને બંધ કામગીરીમાંથી	રપ.૯૨	62.30	16.18	29.23	GY.OY	16.11
	(છ) તરલીકૃત – ચાલુ અને બંધ કામગીરીમાંથી	૨૫.૯૩	૯૨.૩૫	16.10	25.28	ev.0e	16.05

નોંધ : ઉપરોક્ત ત્રિમાસિક / વાર્ષિક નાણાંકીય પરિણામો સેબી ધારો ૨૦૧૫ ના (નોંધણી કરાર અને સ્પષ્ટતાની જરૂરીયાત) નિયમોની કલમ ૩૩ ની આવશ્યકતા અનુસાર સ્ટોક એક્સચેન્જમાં જમા કરાવેલ વિગતવાર પરિણામોમાંથી લીધેલ અનુમાનિત જાણકારી છે. આ ત્રિમાસિક / વાર્ષિક નાણાંકીય પરિણામોની વિગતવાર જાણકારી બીએસઈ લિમીટકની વેબસાઇટ URL : www.bseindia.com/corporates, નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમીટકની વેબસાઇટ URL : www.nseindia.com/corporates અને કંપનીની વેબસાઈટ URL: http://ghcl.co.in/investors/performances-reports/ ઉપર પણ ઉપલબ્ધ છે.

નવી દિલ્હી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩



જીએચસીએલ લિર્મીટેકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી

રમણ ચોપડા સીએફઓ અને એક્ઝીક્યુટીવ ડિરેક્ટર (ફાઈનાન્સ) મેનેજાંગ ક્રિરેક્ટર DIN-00954190





















